

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન એપોઈન્ટ્સ ન્યૂ ઇન્ટિગ્રિટી કમિશ્નર એન્ડ લોબીસ્ટ રજીસ્ટ્રાર (સીટી ઓફ બ્રેમ્પટને નવા ઇન્ટિગ્રિટી કમિશ્નર અને લોબીસ્ટ રજીસ્ટ્રારની નિમાણુક કરી)

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 10, 2019) – આજે, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે જુલાઈ 11 થી અમલમાં આવે તે રીતે ઇન્ટિગ્રિટી કમિશ્નર અને લોબીસ્ટ રજીસ્ટ્રારના સહિયારા પદે લેવિટ્ટ એલ.એલ.પી. (Levitt LLP) ની મુનીઝા શેખની (Muneeza Sheikh) નિમાણુક કરી.

મુનીઝા વચગાળાના (ઇન્ટરિમ) ઇન્ટિગ્રિટી કમિશ્નર તરીકે ફરજ બજાવનાર સુઝાન ક્રેગ (Suzanne Craig) પાસેથી હોદ્દો સંભાળશે.

ઇન્ટિગ્રિટી કમિશ્નર તરીકે, મુનીઝા કાઉન્સિલની આચાર સંહિતા (કોડ ઓફ કન્ડક્ટ) સંબંધિત અરજીઓની સાથે સાથે, શહેરના કોઈપણ બાય-લોઝ (પેટા કાનૂનો), મેયર અને કાઉન્સિલરોની નૈતિક વર્તણૂકને કાબૂમાં રાખતી કાર્યપદ્ધતિઓ, નિયમો અને નીતિઓની દેખરેખ રાખશે.

લોબીસ્ટ રજીસ્ટ્રાર તરીકે પોતાની ભૂમિકામાં, તેણી શહેરની લોબીસ્ટ અને ગિફ્ટ રજીસ્ટ્રીસ, તેમજ લોબીસ્ટ આચાર સંહિતાને લાગુ કરશે. લોબીસ્ટ રજીસ્ટ્રાર પાસે ફરિયાદોની તપાસ કરવાની અને પ્રતિબંધો લાદવાની સત્તા હોય છે જો વગદાર પ્રવૃત્તિ જાહેર ન કરવામાં આવે અથવા જો કોઈ વ્યક્તિએ લોબીસ્ટ આચાર સંહિતાનો ભંગ કર્યો હોય.

બંને ભૂમિકાઓ માટે, તેણી ફરિયાદો, તપાસો અને સલાહનો સારાંશ કરીને અહેવાલો બનાવશે અને શહેરની ઉત્તરદાયિત્વ પ્રક્રિયાને જરૂરી કોઈ સુધારણાઓની ભલામણો કરશે.

મુનીઝા વિશે

મુનીઝા લેવિટ્ટ એલ.એલ.પી.માં (Levitt LLP) સીનિયર પાર્ટનર છે અને GTA માં કામદાર અને રોજગાર કાયદાઓમાં (લેબર અને એમ્પ્લોયમેન્ટ લોઝમાં) નિપુણતા ધરાવે છે. વિશાળ કંપનીઓ સાથે કામ કર્યું હોવાથી, મુનીઝા નિષ્ણાત જાણકારીની સમૃદ્ધિ ધરાવે છે, અને તેણીએ કાર્યસ્થળે વિવિધતામાં પ્રવૃત્તમય રહેવાના મહત્વ પર સંખ્યાબંધ વર્કશોપ્સનું સંચાલન પણ કર્યું છે. પોતાની આગવી વિચારશૈલી માટે જાણીતી, મુનીઝા કેરોલ મેકનેઈલ (Carole MacNeil) સાથે CBC પેનલ સહિતના, મોટા કેનેડિયન બ્રોડકાસ્ટ મીડિયામાં નિયમિતપણે જોવામાં આવે છે.

પોતાના નવરાશના સમયમાં, તેણી કેનેડિયન મુસ્લિમ વોટ માટે ડાયરેક્ટર ઓફ કોમ્યુનિકેશન્સ છે, લોકશાહી પ્રક્રિયામાં મુસ્લિમ કેનેડિયનોને પ્રવૃત્તમય રહેવાનું પ્રોત્સાહન આપે છે.

અવતરણ (ક્વોટ)

“બ્રેમ્પટનના નવા ઇન્ટિગ્રિટી કમિશ્નર લોકશાહી પ્રક્રિયા માટે ન કેવળ આગેવાન કાયદેસર નિષ્ણાત અને વકીલ છે, પરંતુ બ્રેમ્પટનની બહુ વિવિધતાભરી રચનાને પણ રજૂ કરે છે. તેણી બ્રેમ્પટનના ઇતિહાસમાં ઇન્ટિગ્રિટી કમિશ્નર તરીકે સંપૂર્ણ કરાર પર નિયુક્ત થનારી પહેલી મુસ્લિમ મહિલા છે. પોતાની આગેવાનીથી સહાયતા મેળવીને, આ કાઉન્સિલ પારદર્શકતા અને સરકારી ઉત્કૃષ્ટતા માટે કટિબદ્ધ છે જે બ્રેમ્પટનને સારી રીતે શહેર ચલાવવા માટે પાયાની જરૂરિયાત હોય.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca